

Date: 09/02/2024

To, Gen. Manager (DCS) BSE Limited. P J Towers, Dalal Street, Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531913 (GOPAL IRON & STEELS COMPANY (GUJARAT) LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 31st December, 2023 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said unaudited financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 08th February, 2024.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

FOR, GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED

MRS. KUNDANBEN PATEL MANAGING DIRECTOR

K-B. Patel

(DIN: 03063504)

GISCO GIANTINA GIANTI

IDFC FIRST

and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792 istered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031 Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstw Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the low-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as pe the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as pe contractual rate with effect from their respective dates

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice	Property Address
1	41012628	Home Loan	1. Mr. Ansari Niyaj Ali 2. Mrs. Naziyakhatun Niyaz Ansari	25.01.2024	INR 6,36,762.95/-	All That Piece And Parcel Of Immovable Property Bearing Plot No. 59, Admeasuring 44.65 Sq. Mts. i.e. 53.40 Sq. Yard, Along With 28.57 Sq. Mts. i.e. 34.17 Sq. Yard Undivided Share In The Land Of Road Margin, Total Admeasuring 73.22 Sq. Mts. i.e. 87.57 Sq. Yard In "Royal Residency", Sitaute At Survey No. 158/2, Block No. 153/A Admeasuring He.are 3-15-13 Sq. Mts., Of Moje Village Kothwa, Ta: Mangrol, Dist: Surat, Gujarat-394210, And, Bounded As: East: Plot No. 32, West: Society Road, North: Plot No. 60, South: Plot No. 58

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, fallin which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against th mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited nated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Date: 09.02.2024 Place : Surat

(Borrower).

Place: Gujarat

Date: 09.02.2024

(Co-Borrower)

Mamtaben Ajitbhai Taviya

14 (Loan Code No. 03710000546/

Rajubhai Dineshbhai Parmar

(Borrower), Vasantben Dineshbha

Parmar & Dineshbhai Govindbhai

Surendranagar Branch)

Parmar (Co-Borrowers)

Authorized Office **IDFC First Bank Limite** (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited

Aadhar

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.

Surat Parvat Patiya Branch: Shop No.312&313, Times Galleria, Nr Saroli Village Gate, Opp Kuberji World Textile Market, Surat Kadodara Road, Surat- 395010, GJ

Ankleshwar Branch: Shop B-63,1st Floor, Signature Galleria, B-wing B/S Uma Bhavan, Near Mahavir turning point,

OLD NH-8, Ankleshwar, Dist- Bharuch, Gujarat-393001 Surat Branch: Office No. 209 & 210, 2nd Floor, Universal Business Center, Near Madhuvan Circle, L.P. Savani Road, Adaian, Surat-395009 GJ

Surendranagar Branch: Shop No. - 327,328 & 329, 3rd Floor, Mega Mall, Near Milan Cinema, S.T.Road, Surendranagar 363001,(GJ)

APPENDIX IV POSSESSION NOTICE (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said

wit	perty and any dealings with the property hinterest thereon.			
Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s) (Name of the Branch)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
1	(Loan Code No. 1230000585/ Surat Parvat Patiya Branch) Lalitaben Ashokbhai Jagatiya (Borrower), Ashokbhai Nanjibhai Jagatiya (Co-Borrower)	All that part & parcel of property Bearing, R S No 88 1 88 2 Block No 188 Flat No 406 4th Floor Sai Leela Resi Mahendra Park Nr Pavitra Residency Off Kamrej Village Road, Surat, Gujarat - 394180. Boundaries: East - Passage and Then Flat No. 504, West - Road, North - Flat No.407, South - Other wing	13-09-2023 ₹ 6,63,898/-	07-02-2024
2	(Loan Code No. 12300001277/ Surat Parvat Patiya Branch) Jyotiben Laljibhai Dhankecha (Borrower), Laljibhai Devchandbhai Dhakecha (Co-Borrower)	All that part & parcel of property Bearing, R S No 56 57 59 Block No 130 Flat No 301 3rd Floor Bhaktidhara Residency Wing B 2 Opp Platinum Palace Off Sayan Gothan Road, Surat, Gujarat - 394130. Boundaries: East - Adj B/3 Building, West - Adj Flat No. B/2 302, North - Adj Flat No. B/2 304, South - Adj Residency Road	11-07-2023 ₹ 3,14,193/-	07-02-2024
3	(Loan Code No. 12300001325/ Surat Parvat Patiya Branch) Kamalaben Arjun Soni (Borrower), Arjun Jaybahadur Soni (Co-Borrower)	All that part & parcel of property Bearing, Flat No.401, 4th Floor, Sai Palace, Plot No, 142 &143, Nr Takshashila School Road, Off. Kim Kosamba Road, Kunwarda, Surat, Gujarat-394120 Boundaries: East - Flat No. 402, West - Other Block, North - Plot No. 140 & 141, South - Passage	08-06-2021 ₹ 3,62,622/-	07-02-2024
4	(Loan Code No. 17500000014/ Ankleshwar Branch) Nayanaben Shileshbhai Kayasth (Borrower), Shaileshbhai Vajeram Kayasth & Sandip Shailesh Kaysth (Co-Borrowers), Kishor Bhai Manilal Mistry (Guarantor)	All that part & parcel of property Bearing, S No 942 A Plot No 216 A Reva Residency Tarsadi Kosamba Road Nr Kosamba Railway Station, Surat, Gujarat-394120. Boundaries: East - Open Plot, West - Plot No. 216, North - Road, South - Plot No. 239	11-10-2023 ₹ 11,31,065/-	07-02-2024
5	(Loan Code No. 12300001426/ Surat Parvat Patiya Branch) Yusufbhai Dagdubhai Pinjari (Borrower), Raishabi Yusufbhai Pinjari (Co-Borrower), Anilbhai Boddula (Guarantor)	All that part & parcel of property Bearing, R S No 20 2 T P S No 39 Royal Palace Apartment Flat No 204 2nd Floor Royal Palace Apartment Plot No A 30 A 31 Gali No 1 Ambanagar Soc Nr Limbayat Police Station, Surat, Gujarat - 394210 Boundaries: East - Road, West - Flat No. 203, North - Plot No. 29, South - Passage, Lift Flat No. 202	13-11-2023 ₹ 7,24,187/-	07-02-2024
6	(Loan Code No. 04200002174/ Surat Branch) Kalpesh Kishorbhai Pavar (Borrower), Supriya Kalpeshbhai Pavar (Co-Borrower), Vasudev Jadav (Guarantor)	All that part & parcel of property Bearing, R S NO 102 1 102 2 Block No Flat No 502 5th Floor Shivalik Residency Shivam Residency Kadodara Palsana, Surat, Gujarat-394327. Boundaries: East - Open Space, West - Passage & Flat No. 505, North - Flat No. 501, South - Flat No. 503	13-11-2023 ₹ 5,93,136/-	07-02-2024
7	(Loan Code No. 04200001812/ Surat Branch) Vandnabai Vilash Patil (Borrower), Mahendra Vilas Patil (Co-Borrower), Ramesh Khairanar (Guarantor)	All that part & parcel of property Bearing, Flat No. 107, 1st Floor, Dhanlaxmi Resi, Shivdhara Residency 2, Nr. Garden Valley Residency, Jolwa, Palsana, Surat, Gujarat-394327. Boundaries : East - Passage & Flat No. 103, West - Garden Valley Society, North - Stair, South - OTS & Flat No. 106	09-08-2021 ₹ 7,89,463/-	07-02-2024
8	(Loan Code No. 1230000388/ Surat Parvat Patiya Branch) Sadhana Dipnarayan Dubey (Borrower), Dipakkumar Tularam Dubey (Co-Borrower), Rajeetram Suryanarayan Mishra (Guarantor)	All that part & parcel of property Bearing, R S No 100 101 Block No 85 Plot No 74 Sai Angan Residency Nr Sai Deep Residency Nr Surat Public School Bagumra Canal Road Jolwa, Surat, Gujarat - 394305. Boundaries: East - Society Road, West - Plot No.75, North - Society Road, South - Plot No.73	11-10-2023 ₹ 15,57,554/-	07-02-2024
9	(Loan Code No. 04200002213/ Surat Branch) Nagendra Mahato (Borrower), Putul Bahen Nagendra Mahto (Co-Borrower)	All that part & parcel of property Bearing, R S No 147 148 Block No 1 Flat No 501 5th Floor Swastik Avenue A Wing A Behind Sargam Shopping Centre Kadoadara Palsana, Surat, Gujarat - 394327. Boundaries: East - Sargam Complex, West - 20 Ft Road, North - Adj. Sub Plot No. 2, South - Road	11-08-2023 ₹ 6,41,933/-	07-02-2024
10	(Loan Code No. 04200001794/ Surat Branch) Dipak Tulsiram Gupta (Borrower), Ankita Gupta (Co-Borrower), Dharmendra Kumar (Guarantor)	All that part & parcel of property Bearing, Block No 224 Flat No A1 Ground Floor Patel Park Building A Kadodra Nagar Palika Road Near Kadodra Chokdi, Surat, Gujarat - 394327. Boundaries: East - Open Space, West - Building No- B, North - Parking, South - Flat No. A/2	11-08-2023 ₹ 11,55,643/-	07-02-2024
11	(Loan Code No. 12300000438/ Surat Parvat Patiya Branch) Laxmidevi Anilkumar (Borrower), Anilkumar BabulaIram (Co-Borrower), Nitin Balugir Gosavi (Guarantor)	All that part & parcel of property Bearing, R S No 201 2 Block No 268 Flat No 404 Wing A 1 4th Floor Vraj Vatika Sai Vatika Row House 2 Opp Sarvottam Hotel, Surat, Gujarat -394305. Boundaries: East - Road, West - Passage and Then Flat No.405, North - Flat No.403, South - Road	18-07-2022 ₹ 6,54,940/-	07-02-2024
	(Loan Code No. 12310000269/ Surat Parvat Patiya Branch) Tarunbhai Chandubhai Ambaliya (Borrower), Komalben Tarunbhai Ambaliya (Co-Borrower)	All that part & parcel of property Bearing, Flat No.304 3rd Floor Gajanand Park Apartment Gali No.4 In Viram Nagar Society Moje: Tunki ((Katargam) On Plot No. A91 Surat, Gujarat - 395004. Boundaries: East - Others Property, West - Passage, stair, flat No.301, North - Flat No.303, South- Other Property	<u>13-11-2023</u> ₹ 10,06,451/-	07-02-2024
13	(Loan Code No. 03710000459/ Surendranagar Branch) Ajitbhai Karamshibhai Taviya (Borrower)	All that part & parcel of property Bearing, G.F and F.F. Unit No.1 Madhav Darshan-B Gadhada Road Botad 65 Paiki West Side Land Botad, Bhavnagar, Gujarat -	11-10-2023 ₹ 9 10 371/-	08-02-2024

364001. Boundaries: Fast - Plot no-65 Paiki Middle

to West Side Land, West - 6.00 Mtr Wide Road, North

7.50 Mtr Wide Road, South- Plot no-64 Paiki Land

All that part & parcel of property Bearing, Ground

Floor Ghanshyam Nagar Bhavnagar Road Botad 7

Paiki North Side Paiki East Side Paiki Land Botad

Bhavnagar, Gujarat -364001. Boundaries: East - Plot

No.8, West - Plot no.7 Paiki West Side Land, North

Side land and Road

Lagu Common Plot, South- Plot No.7 Paiki South

GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED : L27101GJ1994PLC022876 | Regd. Office : B-701, Nirman Complex, B/h. Navrar EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

	FOR THE QUARTER ENDED	ON 31.1	2.2023	_		(R:	s. in Lakhs)
Sr. No		Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 30-09-2023 Unaudited	Quarter ended on 31-12-2022 Unaudited	9 Months ended on 31-12-2023 Unaudited	9 Months ended on 31-12-2022 Unaudited	Year ended on 31-03-2023 Audited
1 2	Total Income from Operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	114.71 0.27	280.84 5.76	39.49 0.6	395.54 5.56	56.63 5.43	127.51 13.29
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	0.27	5.76	0.60	5.56	5.43	13.29
4 5	after Tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the	0.27	5.76	0.60	5.56	5.43	13.29
6	period [Comprising Profit / (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Equity Share Capital	0.00 491.71	0.00 491.71	0.00 491.71	0.00 491.71	0.00 491.71	0.00 491.71
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year Earnings Per Share (of Rs.10/- each)	-557.65	-557.65	-557.65	-557.65	-557.65	-557.65
	(for continuing and discontinued operations) Basic & Diluted :	0.01	0.12	0.01	0.11	0.11	0.27

Notes: (1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.gopaliron.com) (2) The result of the Quarter ended on 31st December, 2023 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 8th February, 2024,

By Order of the Board of Directors For, Gopal Iron and Steels Company (Gujarat) Limited

sd/- Mrs. Kundanben Bhaveshbhai Patel Managing Director - DIN: 03063504 Place: Ahmedabad Date: 08/02/2024

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN: L65110TN2014PLC097792 Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031.

Bank el : +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022 NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION

OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 ing borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erst Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the low-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly escribed in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as pe contractual rate with effect from their respective dates.

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice	Property Address
1	13029869,	Loan	1. Alakh Auto	20.01.2024	INR	All That Piece And Parcel Of Immovable Property, Bearing
	2450699	Against	Garage		20,93,422.70/-	Flat No. 201 On The 2nd Floor, Admeasuring 1296 Sq. Fts.
	&	Property	2. Alpeshbhai			i.e. 120.45 Sq. Mtrs. Saleable & 343.12 Sq. Mtrs. Paiki
	4446894		Rudani			21.55 Sq. Mtrs. Undivided Share In Road Margin & 17.76
			3. Shilpa Rudani			Sq. Mtrs. Undivided Share In The Land Of "Krishna
						Township Building No. A/4", Situate At Revenue Survey No.
						177 & 184, Block No. 181 & 189, Of Moje: Mota Varachha,
						City Of Surat, Gujarat-394101, And Bounded As: East :

South: Flat No. 202/A-4 You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESIAct, against the es mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited amated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 3 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Date: 09.02.2024 Place : Surat

IDFC First Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)

Open Space, West : Passage/ Stair, North : Open Space

STATE BANK OF INDIA Retail Assets Central Processing Centre,

nterest and incidental expenses etc.. within 60 days from the date of receipt of the said notice.

2nd floor SWC Hub, SBI RACPC South, Vasna Bhayli Road, Opp Rajpath Vadodara POSSESSION NOTICE [See Rule 8(1)] (for immovable property)

Whereas, The undersigned being the Authorised officer of the State Bank of India (RACPC). 2nd floor SWC Hub. SBI RACPC South, Vasna Bhayli Road, Opp Rajpath Vadodara, under the Securitization and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest (Second) Ordinance Act, 2002 (Ord. 3 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice calling upon the following Borrowers/Guarantors to repay the amount mentioned in the notice being the amount with furthe

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on them under section 13(4) of the said Ordinance Act read with rule 9 with the said Rules on.

The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any

	Borrower's/Guarantor's Name & Loan A/c No.	Demand Notice Date & Amount(Rs.)		
1.	Bhangi Shantilal Account No. 40797963476, 40801747997	20.11.2023 & Rs. 22,11,982/- + further Interest thereon and incidental Expenses as on 20.11.2023	An immovable property of borrower/mortgagor comprising of land & buildings and erections thereon (both present and future) situated at all that piece and parcel of Regd Distt sub dist. Mouje Sayajipura,RS no. 66/1,66/2,TP no. 1 FP no. 8,Paiki at Plot E/104,Rajlaxmi Society,Sayajipura,Vadodara. Bounded: East: Plot E-103, West: Plot E-105, North: Society Road, South: Plot No. G/117	06.02.2024 Symbolic
2.	Hitesh Kumar Dave & Kailashben Dave Account No. 40532895011, 40533889255, 40538944337	27.11.2023 & Rs. 29,65,003/- + further Interest thereon and incidental Expenses as on 27.11.2023	An immovable property of borrower/mortgagor comprising of land & buildings and erections thereon (both present and future) situated at all that piece and parcel of Regd Distt sub dist. Mauje Bapod RS no. 365 CS no. 526 at house 57 Sharadnagar,LIG scheme Tarsali, Vadodara. Bounded: East: House No. 54, West: House No. 66 & Road, North: House No. 56, South: House no. 58.	06.02.2024 Symbolic
3.	Dipak Parasram Raghuvanshi & Harshita Dipak Raghuvanshi Account No. 38933215110, 39285845092	16.10.2023 & Rs.25,45,919/- + further Interest thereon and incidental Expenses as on 16.10.2023	An immovable property of borrower/mortgagor comprising of land & buildings and erections thereon (both present and future) situated at all that piece and parcel of Regd Distt sub dist. Mauje Savad. RS no. 324, Paiki TP no. 5,OP 35 FP No. 11 at Plot No. D-2 Sukhmani Co Opp Housing Society Savad, Vadodara. Plot area 850 sqft, GF construction 720 Sqft, FF Construction 850 Sqft, Total Construction Area 1570 Sqft. Bounded: East: House No. E-29, West: House No. D-1, North: Society Road, South: Society Road.	06.02.2024 Symbolic

IDFC FIRST Bank Limited

Date: 09.02.2024- Place: Vadodara

and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792 Registered Office: - KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel: +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022

Bank

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwh Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited

amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respectiv

notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates. Name of Section Outstanding

Sr No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers		amount as per Section 13 (2) Notice	Property Address
1	23634215	Home Loan	1. Parul Chetanbhai Patodiya 2. Chetan K Patodiya	13.09.2023	29,84,906.93/-	All That Piece And Parcel Of Property In State: Gujarat, Reg. District & Sub-District: Rajkot, City Survey Ward No. 10, T.P. Scheme No. 5 (Rajkot), Gujarat-360002, F.P.No. 87 Paiki, Rajkot City Area Known As Raghuvir Society, Street No. 4, Revenue Survey No. 301 Paiki Na & For Residential Perpose Building Construction Permited Land Plots Paiki, Plot No. 21 Paiki, Land Admeasuring 76.38 Sq. Yds. i.e. 63.86 Sq. Mtrs.,And Bounded As: East: Road, West: Other's Property, North: Other's Property, South: Road
2	52599464	Home Loan	1. Vaja Ravikumar Dipakbhai 2. Vaja Valiben Dipakbhai	18.11.2023	14,94,581.40/-	All That Piece And Parcel Of Plot No. 59, Admeasuring 49.58 Sq. Mtrs., Of The Area Known As "Radhika Residency" Of Rsn 209 Paikee 2 Of Village-mahika In Sub-dist. & Regi. Dist Rajkot, Dist Rajkot, In The State Of Gujarat-360002 And, Bounded As: East: Plot No. 95, West: 7.50 Mtr. Road North: Plot 58, South: Plot 60

fou are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, nst the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) . Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise

> IDFC First Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited

Regional Stressed Assets Recovery Branch, Surat City Region, Plot No. - 6B, 3rd Floor, Baroda Sun Complex, Ghoddod Road, Surat -395007. Ph. - 0261-2294302, E-mail - sarsuc@bankofbaroda.com

APPENDIX IV [See Rule 8(1)] POSSESSION NOTICE

The undersigned being the Authorized Officer of the Bank Of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Securit Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 05-09-2019 (also published in newspapers on 16-10-2019) calling upon the Borrowers / Guarantors / Mortgagors M/s. Rudranath Textile, Mr. Hirenbhai Bharatbhai Vaghani, Mr. Vinubhai Jerambhai Movaliya and Mr. Vrajlal Kesharbhai Vaghani to repay the amount mentioned in the notice being la 45,75,169.00 (Rupees Forty Five Lac Seventy Five Thousand One Hundred Sixty Nine Only) along with further interest, charges and expenses w.e.f.01-05-2019 within 60 days from the date of notice/date of receipt of the said notice.

The Borrowers / Guarantors / Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantors / Mortgagors and the public in genera that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 07th Day of February of the year 2024 The Borrowers / Guarantors / Mortgagors in particular and the public in general i

hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda** for an amount of **Rs. 45,75,169.00** (Rupees Forty Five Lac Seventy Five Thousand One Hundred Sixty Nine Only) along with further interest, charges and expenses w. e. f. 01-05-2019 and further interest, charges and expenses thereon until full payment.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 o the Act, in respect of time available, to redeem the secured assets

Description of Property

All the right, title and interest in "Office No.408, Opera House, Behind Super Diamond Building, Mini Bazar, Moje.Varachha, Surat City." in the name of Mr.Vrajlal Keshavbha /aghani. Bounded as : North : Entry & Passage, South : T.P. Road & Margin, West Shop No.409, East: Shop No.407

Authorised Officer & Chief Manager Date: 07-02-2024 Bank of Baroda ROSARB, Surat Place: Surat



AMROLI BRANCH Plot No: 134-135, Jeevar Jyot Society, Opp. Mahaveer Society, New Kosad Road, Amroli-394107, Tele.: 0261-2495900 Email: ubin0829048@unionbankofindia.bank

POSSESSION NOTICE [Rule-8(1)]

Whereas The undersigned being the Authorized Officer of the Union Bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement Security Interest Act, 2002(54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 200 issued a demand notice dated 29/09/2023 calling upon the Borrower/Guarantor Mortgagor namely, Mr. Shravan Kumar Mali (Borrower & Mortgagor), Mrs. Lil. Ram (Co-Borrower), Mr. Yagnik Kumar Pravinbhai (Guarantor) to repay the amoun mentioned in the notice being Rs. 16,24,683.75/- (Rupees Sixteen Lakh Twenty Fou Thousand Six Hundred Eighty Three and Seventy Five Paisa Only) with interes within 60 days from the date of receipt of the said notice. The Borrower/Guarantor/Mortgagor having failed to repay the full amount, notice i

hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below

in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 8" Day of February the year 2004. The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India, **Amroli Branch** for an amount of being Rs.16,24,683.75/- (Rupees Sixteen Lakh Twenty Four Thousand Six Hundred

Eighty Three and Seventy Five Paisa Only) as on 29/09/2023 in the said account together with costs and interest as aforesaid.

The Borrower's/Guarantor's/Mortgagor's attention is invited to the provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem th secured assets

Description of immovable property

All the piece and parcel of immovable property bearing Plot No: 151 paiki admeasuring Super Built-up area 46.82 sq.mtrs admeasuring In the project which known as "Jolva Residency" along with undivided proportionate share admeasuring 25.91 sq.mtrs in the land underneath the said building situated on the land bearing R.S. No: 182, Block No: 223, Village: Jolwa, Sub-Di: Palsana, Di: Surat The Property bounded as Belov East: Adjoining Plot No: 182, West: Adjoining Society Road, North: Adjoining Plot No: 152, South: Adjoining Plot No: 151/A. Owned By: Mr. Shravan Kumar Mali

Date: 04/02/2024

यूनियन बैंक 🔰 Union Bank S.Z. (6)

Kannith Branch, 9. Kannith Chauta Pool. Email: UBIN0531103@unionbankofindia.bar Ph: 0261-2593559

POSSESSION NOTICE [Rule-8(1)

Whereas, The undersigned being the Authorized Officer of the Union Bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 ssued a demand notice dated 30-11-2023 calling upon the Borrower/ Guaranto

Mortgagor namely, M/s Feni Ceramics represented by its Proprietor Mi ParitoshDilipbhi Patel (Mortgagor) and Mrs.Sukeshi D.Patel R/o (Guarantor and

Mortgagor) to repay the amount mentioned in the notice being Rs 41,32,098.79 (Rupees Forty One Lakhs Thirty Two Thousand Ninety Eight and Paise Seventy Nine Only) with interest within 60 days from the date of receipt of the said notice.
The Borrower/Guarantor/Mortgagor having failed to repay the full amount, notice i ereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below n exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Ac read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this the 06th Day

of February of the year 2024. The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is hereb cautioned not to deal with the property and any dealings with the property will b subject to the charge of the Union Bank of India, Dadra Branch for an amount of being Rs 41,32,098.79 (Rupees Forty One Lakhs Thirty Two Thousand Ninety Eight and

Paise Seventy Nine Only) as on 29/11/2023 in the said account together with cos and interest as aforesaid. The Borrower's/Guarantor's/Mortgagor's attention is invited to the provision of suf

section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem th

Description of immovable property

All that piece and parcel of the immovable property known as residential flat type property bearing Flat No. 8/701. 7th Floor, Wing Bin "Shakuntala Complex" at Moi Adajan bearing R. S. No 539, TP No 10(Adajan), F.P. No 89 Paiki Sub Plot No.A, B/ Sanghvi Tower Adajan 395009, Tal-Surat City, Dist. Surat in the name of Mrs. Sukes Dilipbhai Patel & Mr.Paritesh Dilipbhai Patel and bounded as under: On The North Open Space, On The South - Passage, Stair & Lift, On The East - Open Space, On Th West : OTS & Flat No B 704

Date: 06/02/2024 Place : Surat

Union Bank Of India.

BARODA EXTRUSION LTD.

Regd. Office :- Survey No 65-66, Village Garadhiya, Jarod - Samalaya Road Ta. Savli, Dist. Vadodara Pin 391520, web.: www.barodaextrusion.com CIN NO.: L27109GJ1991PLC016200 Email, works@barodaextrusion.com

ANNEXURE - I Statement of Standalone Unaudited Results for the nine months ended 31.12.2023 [See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015]

Sr. No.	Particulars	Quarter ending	Figures	months ended in the previous year
		31-DEC-23	31-DEC-23	31-DEC-22
1	Total Income from Operations	2,898.79	9,382.26	3,065.51
2	"Net Profit / (Loss) for the period			
	(before Tax, Exceptional and/or	-5.39	27.68	-269.64
	Extraordinary items#)"			
3	Net Profit / (Loss) for the period			
	before tax (after Exceptional items	-5.39	27.68	-269.64
	and/or Extraordinary items#)			
4	Net Profit / (Loss) for the period after			
	tax (after Exceptional and/or	-5.39	27.68	-269.64
	Extraordinary items#)			
5	Total Comprehensive Income for the			
	period [Comprising Profit/ (Loss) for	-0.54	27.23	-269.64
	the period (after tax) and Other			
	Comprehensive Income (after tax)]			
6	Equity Share Capital	1,490.49	1490.49	1490.49
7	Reserves (excluding Revaluation			
	Reserve) as shown in the Audited	-5322.15	-5322.15	-5322.15
	Balance Sheet of the previous year			
8	"Earnings Per Share (of Rs. 1/- each)			
	(for continuing and discontinued			
	operations) -"			
	1) Basic:	0.00	0.02	-0.18
	2) Diluted:	0.00	0.02	-0.18

a) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the isted entity. (URL of the filings).

b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means the first entity.

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

For, BARODA EXTRUSION LIMITED

Date: FEBRUARY 8, 2024

Place: Vadodara

Din No. 0920021

PARASMAL KANUGO MANAGING DIRECTOR

Authorized Office

Authorised Officer - State Bank of India

IDFC FIRST

Date: 09.02.2024 Place : Guiarat

08-02-2024

₹ 9 10 371/-

11-10-2023

₹ 21,09,791/

Authorised Officer

Aadhar Housing Finance Limited

ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસક તોફાનો કરફ્યુ લાગુ, 'દેખો ત્યાં ઠાર'ના આદેશ

નૈનિતાલ, તા.૮ ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભૂલપુરા ગામમાં એક મદરેસા અને નમાજ સ્થળ પર થયેલુ ગેરકાયદેસર દબાણ તાોડવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરાયા બાદ સ્થાનિક લોકો ડઝન જેટલા વાહનોને આગ ચાંપી ફૂંકી માર્યા હતા. કેટલાય પોલીસ કર્મચારીઓ આ ઘટનામાં ઘાયલ થયા હતા. સ્થિતિ બેકાબુ બનતા નૈનિતાલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ કફર્યુનો અમલ કરી તોફાનીઓને દેખો

ત્યાં ઠારના આદેશ આપ્યા છે. હલ્દવાનીમાં હિંસાના બનાવોને લઈને મુખ્યમંત્રી મદરેસાના ગેરકાયદેસર દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, ડઝન વાહનોને આગ ચાંપી. પથ્થરમારો. અનેક પોલીસ ઘાયલ

પુષ્કરસિંહ ધામીએ મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે ઉચ્ચસ્તારીય બેઠક યોજીનો સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

મુખ્યમંત્રી હલ્દવાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર દબાણો હટાવવા દરમિયાન પોલીસ અને પ્રશાસન અધિકારીઓ પર હુમલાના બનાવને ખૂબજ ગંભીરતાથી લીધો છે. તેમણે શાંતિ ડહોળનારાઓ વિરુધ્ધ સખ્રાઈથી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

નૈનિતાલ અધિકારીએ બનભૂલપુરા વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરીને તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપ્યા છે.

મ્યાનમાર બોર્ડરે ૧૬૪૩ કી.મી. ફેન્સીંગના નિર્ણય બાદ…

ભારતે મ્યાનમાર બોર્ડર સીલ કરી, મુક્ત આવન-જાવન તાત્કાલીક અસરથી બંધ

ઘુસણખોરી રોકવા તેમજ દેશની અમીત શાહે આના માટે દેશની નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંતરિક્ષ સુરક્ષાનો હવાલો

રાખવા માટે મ્યાનમાર સાથે મુક્ત લેવાયો છે.

નવી દિલ્હી તા.૮ 💮 આ અંગે વધુમાં જાણવા આવન જાવન વ્યવસ્થાને ખતમ ભારત અને મ્યાનમાર વચ્ચેની મળતી વિગત મુજબ ભારત અને કરવાનો નિર્ણય લીધો છે. સરહદ ભારતે સીલ કરી દીધી છે, મ્યાનમાર વચ્ચે મકત આવન- ઉદ્ઘેખનીય છે કે મ્યાનમાર સરહદે જેને પગલે મુક્ત આવન-જાવન જાવન તાત્કાલીક અસરથી બંધ ૧૬૪૩ કિલોમીટર લાંબી ફ્રેન્સીંગ વ્યવહાર બંધ થઈ ગયો છે. કરવાની ગૃહ મંત્રાલયે ભલામણ બનાવવાના ગૃહ મંત્રાલયના રોહિંગ્યા શરણાર્થીઓની દેશમાં કરી છે. તેના માટે ગૃહમંત્રી નિર્ણયના એક દિવસ બાદ આ

આ નિર્ણય મ્યાનમારથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફેસલો આપ્યો છે. તેમણે જણાવ્યું છે રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓની કર્યો છે. મ્યાનમાર બોર્ડરે ૧૬૪૩ કે ગૃહ મંત્રાલયે પુર્વોતરની ઘુસણખોરી રોકવા તેમજ દેશની કિલોમીટર લાંબી ફ્રેન્સીંગ કરવામાં વસ્તીને લગતી રચનાને જાળવી આંતરિક સુરક્ષા નિશ્ચિત કરવા

અદાણી ગ્રુપ એક વર્ષ બાદ ફરી ૧૦૦ અબજ ડોલરની કલબમાં સામેલ

એન્ટી મેળવી લીધી છે. અમેરિકન સર્જાયેલા કડાકાભડાકા બાદના અંદાજીત એક વર્ષે સ્થિતિ સામાન્ય જ બનવા સાથે અદાણી ગ્રુપ અબજ ડોલરની કલબમાં આવી ગયુ છે.

અદાણી ગુપની નેટવર્થમાં હતો ત્યારપછી પ્રથમ વખત નેટવર્થ ૫૦ અબજ ડોલર ઓછી છે. ૧૦૦ અબજ ડોલરને પાર પહોંચી

ડોલરને વટાવી ગઈઃ ચાલુ વર્ષે સૌથી મોટી વૃદ્ધિ

મુંબઈ તા.૮ હતી.હિંડનબર્ગ પ્રકરણમાંથી અદાણી અદાણીની સંપતિમાં ૮૦ અબજ ભારતના ટોચના કોર્પોરેટ ગ્રુપ ગ્રુપ બહાર આવી ગયુ હોય ગ્રુપના ડોલરનો ધરખમ ઘટાડો થયો હતો અદાણીએ એક વર્ષ બાદ ફરી વખત તમામ શેરો સતત વધી રહ્યા છે. અને એક તબકકે માત્ર ૩૭.૭ ૧૦૦ અબજ ડોલરની કલબમાં ગૌતમ અદાણી વિશ્વના ૧૨મા અબજ ડોલરની રહી ગઈ હતી.

અદાણી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ શોર્ટસેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ **નેટવર્શ ૧૦૦ અખજ** સુધી પહોંચ્યુ હતું. સર્વોચ્ચ અદાલતે માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ માસમાં તપાસ પુર્ણ કરીને રિપોર્ટ આપવા સૂચના આપી હતી અને વધ્ તપાસની જરૂર ન હોવાનું જાહેર કરતા ગ્રુપની કંપનીઓમાં મંગળવારે ૨.૭ અબજ ડોલરનો નંબરના સૌથી ધનિક બન્યા છે અને ઈન્વેસ્ટરોનો ભરોસો વધવા સાથે વધારો થયો હતો અને ૧૦૦.૭ રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીની રોકાણ વધવા લાગ્યુ હતું.અદાણીની અબજ ડોલરે પહોંચી હતી. અદાણી સંપતિ રેકોર્ડસ્તરે પહોંચી હતી જયારે સંપતિમાં ૨૦૨૩માં સૌથી મોટુ ગ્રુપના ગોટાળાનો હિંડનબર્ગે અદાણીની સંપતિ ૨૦૨૨ના ધોવાણ થયુ હતું. ચાલુ વર્ષે અત્યાર

જાન્યુઆરી ૨૦૨૩માં આક્ષેપ કર્યો સર્વોચ્ચસ્તરની સરખામણીએ હજુ સુધીમાં નેટવર્થમાં ૧૬.૪ અબજ ડોલરનો વધારો છે જે અન્ય અમીરો હિંડનબર્ગના રિપોર્ટ બાદ કરતા સૌથી વધુ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રીની જાહેરાત આચારસંહિતા પહેલાં જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે

દેવાશે. એવું મનાય છે કે આગામી પણ હટાવી દેવામાં આવશે.

નવી દિલ્હી, તા.૮ સપ્તાહમાં લાગુ થઈ જશે.

આઈઓબી દ્વારા આજે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ

શહેરના આશ્રમ રોડ ખાતેની ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા કાલે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ **કાલે 'વોકાથોન'નું** અને તા. ૧૦ના રોજ કરાયું આયોજન વોકાથોનનું આયોજન કરાયું

ઈન્ડિયન ઓવરસીઝ બેંકની રીજીયોનલ ઓફીસ દ્વારા આવતીકાલે આશ્રમરોડ ખાતેની બેંક ખાતે ફ્રી હેલ્થચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. તેમજ તા. ૧૦ના રોજ સવારે ૭-૩૦ વાગ્યે આશ્રમ રોડ ની બેંકથી રિવરફ્રન્ટ થઈને ઈન્કમટેક્સ સુધીની વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરની તમામ બ્રાંચના અધિકારીઓ તેમજ કર્મીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને 💎 રાજ્યસભામાં એક પ્રશ્નના જરૂર નહીં પડે અને નંબર પ્લેટના હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ફોટા પરથી ટોલ વસૂલ કરી એક મોટું નિવેદન આપતાં કહ્યું કે અમે સંસદને ખાતરી આપવા લેવાશે. આ સિસ્ટમ હાઇવે આગામી લોકસભા ચૂંટણી માટે માંગીએ છીએ કે ટોલ સિસ્ટમ માટે અથવા એક્સપ્રેસ વેનો કેટલા આદર્શ આચારસંહિતા લાગુ થાય વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સમય માટે ઉપયોગ થયો તેના તે પહેલા જ દેશમાં સેટેલાઇટ સેટેલાઇટ આધારિત સિસ્ટમ ટૂંક આધારે ટોલ વસૂલી કરશે. ટોલ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી સમયમાં રજૂ કરાશે. ટોલનાકા ફ્રી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે. લો કસભા યૂંટણી માટે તેમણે જણાવ્યું કે હવેથી નવી દરમિયાન, ફાસ્ટેગથી ટોલ ટેક્સ આચારસંહિતા માર્ચના પ્રથમ જીપીએસઆધારિત ટોલ સિસ્ટમ વસૂલીનો ડેટા શેર કરતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટેગથી ૪૯ હજાર કરોડ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. દૈનિક કલેક્શન ૧૭૦થી ૨૦૦ કરોડની વચ્ચે થાય છે.

નામ બદલેલ છે

મે મારુ જુનુ નામ પટેલ શિલ્પા પ્રભુદાસ હતુ તે બદલીને નવું નામ પટેલ શિલ્પાબેન હર્ષદભાઈ રાખેલ છે.

સી-૫૦૪, ઉગતી હાઈટ્સ, કુડાસણ, ગાંધીનગર-૩૮૨૪૨૧

નામ બદલેલ છે

આથી મારૂં જૂનુ નામ મૈત્રીબેન રાજેશભાઈ દોશી હતુ તે બદલીને નવું નામ મૈત્રી રાજેશભાઈ દોશી રાખેલ છે. સરનામું : ડી-૮૨, અવની કોમ્પલેક્ષ, નારણપુરા ગામ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩



નવી દિલ્હીમાં વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોએ યોજેલા વિરોધ પ્રદર્શનને લઈને ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટ નોઈડા સહિત દિલ્હીમાં પ્રવેશતા માર્ગો પોલીસે બંધ કરી દેતા દિલ્હીની બોર્ડર પરના માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો તસ્વીરમાં નેશનલ હાઈવે ૨૪ ઉપર ટ્રાફિક જામમાં વાહનો ફસાયેલા નજરે પડે છે.

દિલ્હી-નોઈડા સરહદ પર ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ

સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને પર બેઠા છે અને દિલ્હી જવાની માગ પર અડગ છે. જો કે, હડતાળ પર બેઠેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.

દિલ્હીમાં ખેડૂતો પોતાની માગને ખેડૂતોની મહાપંચાયત અને દિલ્હી લઈને સંસદ ભવન તરફ કૂચ કરી કૂચને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ છે. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી જાહેર કરી છે. પોલીસના જણાવ્યા છે. ખેડૂતો નોઈડામાં મહામાયા અનુસાર, 'કેટલીક જગ્યાએ રૂટ ફ્લાયઓવરથી આગળ વધ્યા હતા. ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. દિલ્હી દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર અને નોઈડાને જોડતા રસ્તાઓ પર ભારે બેરિકેડ લગાવીને મોટી સુરક્ષા વધારી દેવામાં આવી છે.' ખેડૂતો ગ્રેટર નોઈડા ઓથોરિટીની અટકાવ્યા છે. ખેડૂતો પણ હડતાળ બહોર ઘણાં દિવસોથી દેખાવ કરી રહ્યા છે. તેઓએ ગુરુવારે ઘેરાબંધીની તૈયારી કરી લીધી છે. ખેડૂતોએ કહ્યું હતું કે, 'દિલ્હી કૂચમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને

ખેડૂતોએ સંસદ ભવનનો ઘેરાવ વૃદ્ધો પણ જોડાશે.' **DEBTS RECOVERY TRIBUNAL - I**

Government of India, Ministry of Finance, Department of Financial Services 4th Floor, Bhikhubhai Chambers, 18, Gandhikunj Society, Nr. Kochrab Ashram Ellisbridge, Ahmedabad-380006

(Established u/s. 3 of the Recovery of Debts due to Banks & Financial Institution Act, 1993, for the area comprising Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan Sabarkantha, (Himmatnagar) Banaskantha (Palanpur) of Gujarat state w.e.f. 1st June, 2007) (See Section 25 to 29 of the Recovery of Debts and Bankruptcy Act, 1993 read with Rule 2 of Second Schedule of the Income Tax Act-1961)

CH: PUNJAB NATIONAL BANK

RC No. 16/2021 O.A. No. 312/2018

DEMAND NOTICE

CD No. 1: Kingdom Fashions, A Proprietorship Firm, through its proprietor Mr Nirmal Hansraj Bararia, Flat No. 7, Raju Complex, Gurukul Road, Memnagar, Ahmedabad Also at: E-57, Gandhinagar Electronics Estate, Sector-25, GIDC Gandhinagar. Also at: B-4, Sanskrit Apartment, Alkapuri Society, Ghatlodiya Ahmedabad-61. Also at: C-504, Saurmay Complex, Chanakyapuri Road, S.G. Highway Nr. Swapna Srushti Resort & Water Park, Ahmedabad.

In view of the Recovery Certificate issued in O.A./M.A./Misc.I.A./Exe. Pet. No 312/2018 passed by the Hon'ble Presiding Officer, DRT-1, Ahmedabad an amount of Rs 57,85,955.00 (Rupees Fifty Seven Lakhs Eighty Five Thousand Nine Hundred Fifty Five Only) is due against you.

You are hereby called upon to deposit the above / below sum within 15 days of the ceipt of the notice, failing which the recovery shall be made as per rules

In addition to the sum aforesaid you will be liable to pay: (a) Such interest and cost as is payable in terms of Recovery Certificate

(b) All costs, charges and expenses incurred in respect of the service of this notice and other process that may be taken for recovering the amount due. (Alok Kumar Dixit)

Given under my hand and the seal of the Tribunal, this 03rd day of November, 2023 Next Date: 09.02.2024



વિધાનસભામાં રામધારીસિંહ દિનકરની કવિતા કૃષ્ણની ચેતવણીનું પઠન કર્યુ

રામમંદિર નિર્માણ અને અત્યંત વિધિસર રીતે અને દેશભરમાં દિવાળી ઉજવણી સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે કાશી-મથુરામાં હિન્દુ મંદિરો સાથે જોડાયેલી મસ્જીદો મૂળ હિન્દુ સ્થાન હતા તેવા ચાલતા અદાલતી વિવાદ વચ્ચે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ એ પ્રથમ વખત એક મહત્વના સૂચક નિવેદનમાં ઉતરપ્રદેશ વિધાનસભામાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો માટે પાંચ ગામો જ માંગ્યા હતા જયારે હીન્દુઓ તેમના દેવતાઓ સાથે જોડાયેલા ત્રણ આસ્થા કેન્દ્રો જ માંગે છે! યોગીએ વિધાનસભામાં કરેલા આ વિધાનો ખૂબજ મહત્વના છે. તેઓએ હિન્દી લેખક, કવિ, રામધારીસિંહ દીનકરની કવિતા ક્રિષ્ન કી ચેતવણી ટાંકીને પોતાના મુદાને વ્યાજબી ગણાવ્યો હતો અને એ પ્રથમ વખત બન્ય છે કે ભાજપના ટોચના નેતૃત્વમાં ગણાતા મહત્વના નેતાએ આ પ્રકારે કાશી અને મથુરાના સ્થાન પર દાવો કર્યો હતો અને તે પણ વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે તે પણ મહત્વનું છે.વારાણસીમાં હાલમાં જ અદાલતી ચુકાદાથી

કાનુની જંગ વચ્ચે ભાજપના ટોચના નેતૃત્વમાં સ્થાન મેળવતા યોગી આદીત્યનાથ દ્વારા વિધાનસભામાં કરાયેલા વિધાનો સુચક

હિન્દુ ધર્મસ્થાન તોડીને અહી વિધાનસભામાં રાજયપાલના મસ્જીદનું નિર્માણ કર્યુ હતું તેવા સંબોધનના આભાર પ્રસ્તાવની પુરાવા આર્કીયોલોજીકલ સર્વે ઓફ ચર્ચાએ તેઓએ આ મુદો આગળ ઈન્ડીયાએ કર્યા છે.શ્રી યોદીએ ધરીને હવે તેને અયોધ્યા બાદનો જણાવ્યું કે સમાજ જે ઉંડી આસ્થા બીજો એજન્ડા છે તે નિશ્ચિત કર્યુ ધરાવે છે તે આ ત્રણ સ્થાનો જ છે.

જ્ઞાનવાપી સંકુલમાં પુજાની મંજુરી માંગે છે. ૫૦૦ વર્ષ પુર્વે પાંડવો મળી છે અને મથુરામાં ભગવાન માટે અડધુ રાજય મળ્યુ નહી તો શ્રીકૃષ્ણ જન્મસ્થાન વચ્ચેની ભગવાન શ્રીકૃષ્ણએ ફકત પાંચ ઈદગાહ મસ્જીદ એ ઓરંગઝેબે ગામો જ માંગ્યા હતા પણ અહી અમારી આસ્થા સાથે જોડાયેલા ત્રણ સ્થળો જ માંગીએ છીએ. આ સ્થળો કોઈ સામાન્ય નથી ખદ અમારા ભગવાન સાથે જોડાયેલા છે. તેઓના જન્મસ્થાન છે. તેઓએ કકત કાશી, મથરા પર જ દાવો છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર્ચાવરણ ભવન, સેક્ટર ૧૦ અ, ગાંધીનગર-૩૮૨૦૧૦

જાહેર સૂચના

આથી જણાવવામાં આવે છે કે રહેટ લેવલ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ ઓથોરિટી, ગુજરાતના પત્ર ક્રમાંક SEIAA/GUJ/EC/5(f)/86/2024 તારીખ રજમી જાન્યુઆરી ૨૦૨૪, અંતર્ગત સર્વે નંબર ૧૮૪-૧૮૫-૧૮૬/પી, ગામઃ ચાયરવાડી વાસણા, સરખેજ-બાવળા હાઇવે તા. સાશંદ, અમદાવાદ-૩૮૨૧૧૦ ખાતે આવેલ મેસર્સ ફિનાર લિમિટેક દ્વારા સિન્થેટીક ઓર્ગેનિક કેમિકલ્સ (API અને API ઈન્ટરમીડીચેટ્સ) ઉત્પાદન પ્લાન્ટનું સૂચિત વિસ્તરણ માટે ઈ. આઇ. એ. નોટિફિકેશન તારીખ ૧૪મી સપ્ટેમ્બર ૨૦૦૬ ની જોગવાય હેઠળ પર્યાવરણીય મંજૂરી મળેલ છે.

મંજરી પત્રની નકલ એસ.ઈ.આઇ.એ.એ./એસ.ઈ.એ.સી./જ઼.પી.સી.બી/ એમ.ઓ.ઇ.એફ.એન્ડસી.સી. (http://environmentclearance.nic.in) ઉપર તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પર્યાવરણ ભવન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર ૩૮૨૦૧૦ ઉપર ઉપલબ્ધ છે.

ફોર, મેસર્સ ફિનાર લિમિટેડ (55852)

GOPAL IRON AND STEELS COMPANY (GUJARAT) LIMITED : L27101GJ1994PLC022876 || Regd. Office : B-701, Nirman Complex, B/h. Navrangpura Bus Stand, Ahmedababd - 380 EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2023 (Rs.

_	TOR THE QUARTER ENDED	011 0212			4	1	o. III Editio
Sr. No	Particulars	Quarter ended on 31-12-2023 Unaudited	Quarter ended on 30-09-2023 Unaudited	Quarter ended on 31-12-2022 Unaudited	9 Months ended on 31-12-2023 Unaudited	9 Months ended on 31-12-2022 Unaudited	Year ended on 31-03-2023 Audited
1	Total Income from Operations	114.71	280.84	39.49	395.54	56.63	127.51
2	(before Tax, Exceptional and / or Extraordinary items)	0.27	5.76	0.6	5.56	5.43	13.29
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	0.27	5.76	0.60	5.56	5.43	13.29
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	0.27	5.76	0.60	5.56	5.43	13.29
5		0.00	0.00	0.00	0.00	0.00	0.00
6	Equity Share Capital	491.71	491.71	491.71	491.71	491.71	491.71
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited	101.71	100000000000000000000000000000000000000	-2000 ACC.	7.70.7071.51.	,01.71	101.71
8	Balance Sheet of Previous Year Earnings Per Share (of Rs.10/- each)	-557.65	-557.65	-557.65	-557.65	-557.65	-557.65
	(for continuing and discontinued operations) Basic & Diluted :	0.01	0.12	0.01	0.11	0.11	0.27

Notes: (1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.gopaliron.com) (2) The result of the Quarter ended on 31st December, 2023 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 8th February, 2024,

By Order of the Board of Directors For, Gopal Iron and Steels Company (Gujarat) Limited

sd/- Mrs. Kundanben Bhaveshbhai Patel

XX Karnataka Bank Ltd. હેડ ઓફિસ- મેંગલુરુ-૫૭૫ ૦૦૨ એઆરએમ શાખા: મંબઈ રજે માળે ઈ-બ્લોક ધ મેટોપોલિટન

CIN: L85110KA1924PLC001128

ઇ-હરાજી વેચાણ જાહેર નોટિસ

ધી શિક્યોરિટાર્પઝેશન એન્ડ રિકન્સ્ટક્શન ઓક ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓક સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ને ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ)નિયમો, ૨૦૦૨ના નિયમ ૮(૬) અને ૯(૧)ની જોગવાઈ સાથે વંચાણે લેતા હેઠળ સ્થાવર મિલકત/તોન

ાાણની ઈ-હરાજી વેચાણ નોટિસ અત્રે જાહેર જનતાને સામાન્ય રીતે અને દેશદાર(રો)ને અને જામીનદાર(રો)ને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્શન કરેલ સ્થાવર મિલકતો સિક્યોર્ડ લેશદાર પાસે ગિરવે રાખેલ છે, જેનો કબજો અધિકૃત અધિકારીએ લીધો છે (કબજાની વિગતો નીચે આપેલ છે) તેનું વેચાશ 'જેમ જ્યાં છે', 'જે છે તે છે', અને 'જે કાંઈ છે તે છે 'તે ના આધારે તા.૧૨-૦૩--૨૦૨૪ના રોજ નીચે જણાવેલ સમયે આગળના વ્યાજ અને કોસ્ટ સાથે સહિતની કર્યાટક બેંક લિ. એ લેવાની થતી રકમની વસૂલાત માટે વેચાણ થશે વિગતો નીચે મુજબ છેઃ રિઝર્વ કિંમત અને અર્નેસ્ટ મની ડિપોઝીટની વિગતો નીચે મુજબ છે અને અર્નેસ્ટ મની ડિપોઝીટ ૧૧-૦૩-૨૦૨૪ના રોજ બપોરે ૦૪.૦૦ વાગ્યા સુધી કે તે અગાઉ ઓનલાઇન ખાતામાં (જેની વિગતો નીચે આપેલ છે) ચૂકવણી કરવાની રહેશે.

i.	શાખાનું	દેણદારો/ જામીનદારોનાં નામ	બાકી રકમ રૂ.	સ્થાવર મિલકત/તોનું વર્ણન	રિઝર્વ કિંમત (આરપી)	હરાજીનો સમય	ઈએમડી જમા	
	નામ	સરનામાં			અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી) રૂ.	બીડમાં વધારો કરવાની રકમ રૂ	કરાવવા માટે ખાતા • / આઇએફએસસી કે	
	ભાવનગર શાખા	શાખા ભાગીદારી કંપની જેના પ્રતિનિધિ	ભાગીદારી કંપની જેના પ્રતિનિધિ ભાગીદારોઃ (અ) શ્રી. મનીષકુમાર અને ધૈયા પંદરપરા)	આઇટેમ નં.૧- ગામ મોજે નાના મવા તાલુકોઃ રાજકોટ, જિલ્લો રાજકોટ, આઇઓસી કોલોની સામે, જયોતિનગર, ક્રિસ્ટલ મોલ પાસે, કાલાવડ રોડ સામે, નાના મવા, રાજકોટ ખાતે આવેલ સર્વે નં. ૯૧ પૈકી, ફાઇનલ પ્લોટ નં. ૭૮૩, ઓરિજિનલ પ્લોટ નં. ૨૬બી ટીપીસ્કીમ નં.૨ના શિલ્પન વિલા-એ નામની બિલ્ડિંગમાં તે શ્રી મનીપકુમાર હેમંતસિંહ	રૂ.૬૪,૬૪,૦૦૦.૦૦ (અંકે રૂપિયા ચોસઠ લાખ ચોપન હજાર પૂરા)	૧૨-૦૩-૨૦૨૪ સવારે ૧૨.૨૦થી બપોરે ૧૨.૪૦		
		વસંતબેન હેમંતસિંહ ભટ્ટી અને ક) શ્રીમતી ભટ્ટી કાજલબેન કેતનકુમાર, સરનામું : એસ્સાર પેટ્રોલ પંપ	રૂ.૪,૩૮,૭૬,૩૮૮.૦૦ પીએસઓડી ખાતા નં. ૯૪૧૭૦૦૦૬૦૦૦૦૦ન૦૧માં ૦૧-૦૨-૨૦૨૪થી થતા ભાવિ વ્યાજ સહિત રૂ. ૧૯,૪૪,૪૯૨.૦૦	ભટ્ટીની માલિકીનો રહેણાંક ક્લેટ નં. એ-3૦૨ ધારક માપણી ૮૮.૨૯ ચો. મી. એટલે કે ૯પ૦ ચો.કીટ અવિભાજિત હિસ્સા સાથે, સીમાઓઃ પૂર્વે ક્લેટ નં.૩૦૩, પશ્ચિમેઃ માર્જિન જગ્યા પછી રોડ, ઉત્તરેઃ માર્જિન જગ્યા પછી રોડ, દક્ષિણેઃ ફ્લેટ નં.૩૦૧.	રૂ.૬,૪૬,૪૦૦.૦૦ (અંકે રૂપિયા છ લાખ છેંતાળીસ હજાર ચારસો પૂરા)	₹.٩,००,०००/-		
		સામે, રોલિંગ મીલ, સારંગપુર રોડ, બોટાદ, ભાવનગર, ગુજરાત-૩૬૪૭૧૦. (૨) શ્રી મનીષકુમાર હેમંતસિંહ ભટી	પીએસટીએલ ખાતા નં. ૯૪૧૭૦૦૧૮૦૦૦૦૩૮૦૧ માં ૦૧-૦૨-૨૦૨૪થી થતા ભાવિ વ્યાજ સહિત રૂ.૪૪૦,૨૮,૨૨.૦૦ પીએસટીએલ/એકા.નં. ૯૪૧૭૦૦૧૮૦૦૦૦૪૮૦૧માં	આઇટેમ નં. ૨: મોજે ગામ થલતેજ, શીલજ ક્રોસિંગ પહેલા, વૃંદાવન બંગલો સામે, ઘોઘા મહારાજ મંદિર પાસે, થલતેજ અમદાવાદ ખાતે જૂના રેવન્યુ સર્વે નં. ૪૦૮/૨,૪૩૯/૩ અને ૪૩૯/૪, ફાઇનલ પ્લોટ નં. ૮૪/૨ ધા૨ક જમીન પર ટીપીસ્કીમ નં.૩૭ના ૭૬૫૬ ચો.મી. માપણી પર આવેલ શ્રી મનીપકુમાર હેમંતસિંહ ભદ્રીની માલિકીનો બ્લોક ઈ, કસ્તુરી ૩માં આવેલ	રૂ.૨,૧૧,૦૧,૯૩૦.૦૦ (અંકે રૂપિયા બે કરોડ અગિયાર લાખ એક હજાર નવસો ત્રીસ પૂરા)	૧૨-૦૩-૨૦૨૪ બપોરે ૧૨.૪૦થી બપોરે ૦૧.૦૦		
		તે શ્રી હેમંતસિંહ ભદ્દીના દીકરા (૩) શ્રીમતી વસંતબેન તે શ્રી હેમંતસિંહ ભદ્દીનાં પત્ની (૪) શ્રીમતી ભદ્દી કાજલબેન	૦૧-૦૨-૨૦૨૪થી થતા ભાવિ વ્યાજ સહિત. રૂ.૧૪,૫૩,૧૬૬.૦૦ પીએસટીએલ! એકા.નં. ૯૪૧૭૦૦૧૮૦૦૦૦૪૬૦૧ માં ૨૨-૦૧-૨૦૨૪થી થતા ભાવિ વ્યાજ સહિત. રૂ.૧૬૪,૩૦,૩૫૩.૦૦	રહેલાંક ફ્લેટ યુનિટ નં. ૧૦૧, ૨૧૩.૩૦ ચો.મી., ૧લે માળે (મંજૂર થયેલ પ્લાન મુજબ ભોંયતળિયે) મિલકતની સીમાઓઃ પૂર્વેઃ ફ્લેટ નં. ઈ-૧૦૨, પશ્ચિમેઃ આકાશ સુધી ખુલ્લું, ઉત્તરેઃ આકાશ સુધી ખુલ્લું, દક્ષિણેઃ આકાશ સુધી ખુલ્લું.	રૂ.૨૧,૧૦,૧૯૩.૦૦ (અંકે રૂપિયા એકવીસ લાખ દસ હજાર એકસો ત્રાણું પૂરા)	₹.٩,००,०००/-		
		કેતનકુમાર તે શ્રી કેતનકુમાર હેમંતસિંહ ભદ્દીનાં પત્ની (પ) શ્રી હેમંતસિંહ નાનુભાઈ ભદ્દી તે શ્રી નાનુભાઈ ભદ્દીના દીકરા (દ) શ્રી કેતનકુમાર હેમંતસિંહ	પીએસટીએલ/ એકા.નં. ૯૪૧૭૦૦૧૮૦૦૦૫૩૦૧ માં ૨૦-૦૧-૨૦૨૪થી થતા ભાવિ વ્યાજ સહિત. અને રૂ.૧,૦૪,૯૬,૨૦૬.૧૫ એકા.નં. ૯૪૧૭૦૦૪૪૦૦૦૦૦૧૦૧ માં ૦૧-૦૨-	3) આઇટમ નં. ૩: મોજે ગામ બોટાદ, એસ્સાર પેટ્રોલ પમ્પ સામે, રોલિંગ મીલની બાજુમાં, બોટાદ સાળંગપુર રો. બોટાદ, તાલુકો: બોટાદ, જિલ્લો: ભાવનગર ખાતે આવેલ બિનખેતી ઔદ્યોગિક જમીન મિલકત માપક્ષી 3 એકર અને ૮ ગુંઠા અથવા ૧૩૧૦૧ ચો.મી. તે રેવન્યુ સર્વે નં. ૯૭૧ ધારક પૈકી જમીનનો પૂર્વીય ભાગ, પૈકી (કુલ માપણી દ એકર અને ૧૫ ગુંઠા અથવા ૨૫૭૯૯ ચો.મી.) તે શ્રી મનીષક્રમાર હેમતસિંહ ભર્દી, શ્રીમતી વસંતીબેન	રૂ.૯,૨૬,૨૪,૦૭૦.૦૦ (અંકે રૂ. નવ કરોડ છવ્વીસ લાખ ચોવીસ હજાર સિત્તેર પૂરા)	૧૨-૦૩-૨૦૨૪ બપોરે૦૧.૦૦થી બપોરે૦૧.૨૦		
		ભક્રી તે શ્રી હેમંતસિંહ ભક્રીના દીકરા. નં.૨થી નં.૬નું સરનામું પ્લોટ નં. ૧૨ એ, લક્ષ્મી સોસાયટી, પાળિયાદ રોડ,	૨૦૨૪થી થતા ભાવિ વ્યાજ સહિત વત્તા કોસ્ટ્સ. ૩.૨,૦૧,૭૬૩.૦૦ વિરોધ કરેલ ભિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૧૫૦૧ ૩.૬૩,૩૫,૩૬૬.૦૦	રૂ.૨,૦૧,૭૬૩.૦૦ વિરોધ કરેલ ભિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૧૫૦૧ રૂ.૬૩,૩૫,૩૬૬.૦૦	હેમંતસિંહ ભટ્ટી અને શ્રીમતી ભટ્ટી કાજલભેન કેતનકુમારની માલિકીની મિલકત. સીમાઓ: પૂર્વે: અડીને સર્વે નં. ૯૭૨/પી, પશ્ચિમેઃ સર્વે નં. ૯૭૧/પૈકી બાકીની જમીન,ઉત્તરેઃ બોટાદ સાળંગપુર રોડ, દક્ષિણેઃ ગાડા માર્ગ.	રૂ.૯૨,૬૨,૪૦૭.૦૦ (અંકે રૂપિયા બાલું લાખ બાસઠ હજાર ચારસો સાત પૂરા)	3.9,00,000/-	
		જીએચબી સામે, બોટાદ, ગુજરાત-૩૬૪૭૧૦. (૭) શ્રી ગોહિલ અશ્વિનસિંહ એમ. તે શ્રી મતિયાવીરસિંહ માનસિંહ	વિરોધ કરેલ મિલ હેઠળ નં. ૯૪૧૭૦૦૩૯૦૦૦૦૧૬૦૧ રૂ. ૪૨,૯૧,૮૩૫.૦૦ વિરોધ કરેલ મિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૧૭૦૧ રૂ.૫,૧૦,૭૮૮.૦૦	આઇટમ નં. ૪: મોજે અલાઉ તાલુકોઃ રાષ્ક્રપુર, જિલ્લો બોટાદ ખાતે શ્રી કેતનકુમાર હેમંતસિંહ ભટ્ટી અને અશ્વિનસિંહ મહાવીરસિંહ ગોહિલની માલિકીની સ્થાવર મિલકત તે કુલ જમીન માપણી ૨૯૨૩૮.૦૦ ચો.મી.(બોટાદ પાળિયાદ એચટી લાઇન પોલ નં. ૨૯ની બાજુમાં)પૈકી ખાલી ઔદ્યોગિક પ્લોટ જે અલાઉ રેવન્યુ સર્વે નં. ૨૮૩/૧, પૈકી ૨ માપણી ૨૧૦૩૦ ચો.મી.મિલકતની સીમાઓઃ પૂર્વેઃ સર્વે નં. ૨૮૩/૩ પી ૨ની જમીન, પશ્ચિમેઃ દાદાભાઈ ટપુભાઈ ખાચરની જમીન, ઉત્તરેઃ સર્વે નં. ૨૮૩/૧પીની જમીન, દક્ષિણેઃ ૨૮૩/૨પીની જમીન.	રૂ.૩,૧૫,૪૫,૦૦૧.૦૦ (અંકે રૂ. ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ અને એક પૂરા)	૧૨-૦૩-૨૦૨૪ બપોરે ૦૧.૨૦થી બપોરે ૦૧.૪૦		
		ગોહિલના દીકરા સરનામું : ભંડારભાગ, કેમ- વરતેજસિદસર, ભાવનગર, ગુજરાત-૩૬૪૦૬૦	વિરોધ કરેલ બિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૧૮૦૧ ૨.૧૨,૫૧,૦૨૫.૦૦ વિરોધ કરેલ બિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૧૯૦૧		રૂ.૩૧,૫૪,૫૦૧.૦૦ (અંકે રૂપિયા એકત્રીસ લાખ ચોપન હજાર પાંચસો એક પૂરા)	₹.٩,००,०००/-		
			રૂ. ૫૫,૯૮,૭૩૨.૦૦ વિરોધ કરેલ ભિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૨૦૦૧ રૂ.૧૪,૫૪,૪૪૧.૦૦ વિરોધ કરેલ ભિલ હેઠળ	આઇટમ નંપ: પલિયડ રોડ, જીએચબી સામે, પાર્ચનાથ ફલેટની બાજુમાં, બોટાદ, તહેસિલ અને તાલુકો બોટાદ, જિલ્લો ભાવનગર ખાતે રેવન્યુ સર્વે નં. ૬૭૬/૨ પૈકી, સિટી સર્વે નં. ૬૦૫૪/૧૨, પ્લોટ નં. ૧૨/એ, લક્ષ્મી સોસાયટી ખાતે આવેલ શ્રી હેમંતસિંહ નાનુભાઈ ભક્ષીની માલિકીની રહેણાંક જમીન માપણી ૨૧૯.૮૪ ચો. મી. અને એની પર બાંધલ ભિદિંગ	રૂ.૧,૦૧,૧૩,૧૩૦.૦૦ (અંકે રૂ. એક કરોડ એક લાખ તેર હજાર એકસો ત્રીસ પૂરા)	૧૨-૦૩-૨૦૨૪ બપોરે૦૧.૪૦થી બપોરે૦૨.૦૦		
			નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૨૧૦૧ અને રૂ.૨૭,૮૯,૩૭૩.૦૦ વિરોધ કરેલ બિલ હેઠળ નં.૯૪૧૭૦૦૩૯૦૦૦૦૨૨૦૧ તે મંજર થયેલ શરતો મજબ લાગ પડતા વ્યાજ સાથે	(બ-૨) મિલકતની સીમાઓઃ પૂર્વેઃ અડીને આવેલ પ્લોટ નં. ૧૨/બી, પશ્ચિમેઃ રોડ, ઉત્તરેઃ અડીને આવેલ પ્લોટ નં. ૧૧/એ, દક્ષિણેઃ અડીને આવેલ પ્લોટ નં. ૧૩	રૂ.૧૦,૧૧,૩૧૩.૦૦ (અંકે રૂપિયા દસ લાખ અગિયાર હજાર ત્રણસો તેર પૂરા)	રૂ.૧,૦૦,૦૦૦/-		
				કબજો તારીખ/ કબજાનો પ્રકાર ૨૦.૧૨.૨૦૨૨, ૨૧.૧૨.૨૦૨૨ અ				

(દેશદારનું /ગિરવેદારનું સિક્યોર્ડ અસ્ક્યામતો છોડાવવાની સમયમર્યાદા અંગે કાયદાના સેક્શન ૧૩ના સબસેક્શન(૮)ની જોગવાઇઓ તરફ ધ્યાન દોરવામાં આવે છે.)

વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે કર્ણાટક બેંકની વેબસાઇટ એટલે કે www.karnatakbank.comમાં શીર્ષક 'ગિરવે મિલકત વેચાણ માટે' હેઠળ આપેલ લિંક જુઓ.

ઈ-હરાજી પોર્ટલ https://bankauctions.in/ પર ૧૨–૦૩-૨૦૨૪ના રોજ ઉપર જણાવેલ સમયે ૦૫ મિનિટના અસીમિત એક્સ્ટેન્શન સાથે યોજાશે.. ઇચ્છક બીડરે તેમના નામ https://bankauctions.in/ પર નોંધાવવાના રહેશે અને મે. ૪ક્લોઝર ∉૦૫એ, ૬કે માળે, મૈત્રીવનમ, અમીરપેટ, હૈદ્રાબાદ-૫૦૦૦૩૮ પાસેથી નિઃશુલ્ક યુઝર આઇડી અને પાસવર્ડ અને ઈ-હરાજી અંગે (લગભગ ૧૧-૦૩-૨૦૨૪ સુધીમાં) ઓનલાઇન તાલીમ મેળવી લેવા. સંપર્ક નંબર:૦૪૦-૨૩૭૩૬૪૦૫,

સહી/- ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી,



સ્થળઃ મુંબઈ

તારીખ: ૦૭-૦૨-૨૦૨૪









